

OSIAJEE TEXFAB LIMITED

Regd. Off.: 362, Anjani Industrial Estate, Vibhaag-3, Gothan, Olpad, Surat - 394130.

Website: www.osiajeehdl.com Email: osiajee.textfab@gmail.com Mob: 8769941945

CIN: L17299GJ1995PLC024606

18th February, 2019

BSE Limited

Corporate Services Department,

Dalal Street, Fort

Mumbai - 400001

Scrip ID:- **OSIAJEE**

Scrip Code :- **540198**

Ahmedabad Stock Exchange

Kamdhenu Complex,

Opp. Sahajanand College,

Paranjapole, Ambawadi,

Ahmedabad- 380015

Sub: Publication of Unaudited Financial Results for the Quarter & nine months ended 31st December, 2018

Dear Sir,

This is with reference to Regulation 47(1) (b) of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, enclosing herewith copies of the following newspaper dated 16th February, 2019 in which the Unaudited Financial Results of the Company for the quarter and nine months ended on 31st December, 2018 have been published:

1. Business Standards (English Daily)
2. Jai Hind (Gujarati Daily)

This is for your information and records.

Thanking you,


For Osiajee Textfab Limited

v.u.gawad

(Vidya Gawand)

Director

DIN: 07155987



Encl: a/a

OSIAJEE TEXTFAB LIMITED				
362, Anjani Industrial Estate, Vibhaga-3, Gohar, Old Suraj-Surat Road, Gujarat. CIN: L17299G1995PLC024606				
Tel no.: 8769941645, Website: www.osiajeehd.com, Email: osiajee.textfab@gmail.com				
EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED 31ST DECEMBER, 2018 (Rs. In Lakhs)				
PARTICULARS	Quarter Ended	Months Ended	Quarter Ended	
	31.12.2018	31.12.2018	31.12.2017	31.12.2017
Total Income from operations (net)	76.45	76.45	200.13	200.13
Net Profit / (Loss) from ordinary activities after tax	40.11	35.19	5.50	5.50
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary Items)	40.11	35.19	5.50	5.50
Equity Share Capital	540.00	540.00	540.00	540.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	-
Earnings Per Share (before and after extraordinary items)	0.74	0.65	0.10	0.10
a) Basic:	0.74	0.65	0.10	0.10
b) Diluted:	0.74	0.65	0.10	0.10

Note: The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the quarter & nine months ended 31st December, 2018 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Financial Results for the quarter & nine months ended 31st December, 2018 are available on the website of BSE Limited - www.bseindia.com where the securities of the Company are listed and is also available on the website of the Company - www.osiajeehd.com.

For Osiajee Textfab Limited
Sd/-
(Vidya Gaward) Director DIN: 07155987

Date: 14.02.2019
Place: Surat

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST (Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)	
RELEVANT PARTICULARS	
1. Name of Corporate Debtor	Krishna Godavari Power Utilities Limited
2. Date of incorporation of Corporate Debtor	July 05, 1995
3. Authority under which Corporate Debtor is incorporated / registered	Registrar of Companies - Hyderabad
4. Corporate identity number / limited liability identification number of corporate debtor	CIN: U40109TG1995PLC020948
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	Regd. Office - Plot No.265N, Road No.10, Jubilee Hills, Hyderabad-500033, Telangana.
6. Insolvency commencement date of the corporate debtor	December 04, 2018
7. Date of invitation of expression of interest	16.02.2019
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Minimum Eligibility Criteria for Resolution Applicant to approach the Resolution Professional ("RP") with Resolution Plans: a. For Individual(s), Private/Public Limited Company, LLP, body corporate whether incorporated in India or outside India: Minimum Net Worth of INR 25 crores as at the end of the immediately preceding financial year, supported by Documentary Evidence. b. For Financial Investor (FI)/ Mutual Funds/ Private Equity / Venture Capital Funds, Domestic/ Foreign Investment Institutions, Non-Banking Finance Companies (NBFC), Asset Reconstruction Companies, Banks and similar entities: Assets under Management / Loan Portfolio/Committed funds available for investments of INR 100 crores prior to the date of the immediately preceding financial year, supported by Documentary Evidence. Complete details can be sought by E-mailing at crp.kgpul@gmail.com
9. Norms of availability applicable under section 29A is available at	Available at website of IBBI: https://ibbi.gov.in/ and also the details can be sought by emailing at crp.kgpul@gmail.com
10. Last date for receipt of expression of interest	04.03.2019
11. Date of issue of provisional list of prospective resolution applicants	14.03.2019
12. Last date for submission of objections to provisional list	19.03.2019
13. Date of issue of final list of prospective resolution applicants	29.03.2019
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	19.03.2019
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Resolution Applicant(s) included in the provisional list will be provided evaluation matrix, information memorandum and request for resolution plan through e-mail as provided under serial no. 21. The same shall be provided after submission of confidentiality undertaking by the Resolution Applicant(s).
16. Last date for submission of resolution plans	18.04.2019
17. Manner of submitting resolution plans to resolution professional	Sealed Envelope by Post / by hand to RP at the correspondence address as provided under serial no. 21 & electronic copy by email at crp.kgpul@gmail.com
18. Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	18.05.2019
19. Name and registration number of the resolution professional	Name: SANJAY KUMAR DEWANI Regn No.: IBBI/PA-001/IP-P00423/2017-18/10746
20. Name, Address and e-mail of the resolution professional, as registered with the Board	Name: SANJAY KUMAR DEWANI Address: 133, Bhagirathi Appts, Plot No.13/1, Sector-9, Rohini, New Delhi-85 Email ID: sanjaydewani@gmail.com Address: D-55, Defence Colony, New Delhi-110024 Email ID: crp.kgpul@gmail.com
21. Address & email to be used for correspondence with the resolution professional	Address: D-55, Defence Colony, New Delhi-110024 Email ID: crp.kgpul@gmail.com
22. Further Details are available at or with	Details can be sought by Emailing at crp.kgpul@gmail.com
23. Date of publication of Form G	16/02/2019

Sd/-
SANJAY KUMAR DEWANI
(Resolution Professional)
In the matter of Krishna Godavari Power Utilities Ltd.
IBBI/PA-001/IP-P00423/2017-18/10746
Address: D-55, Defence Colony, New Delhi-110024, E-mail: crp.kgpul@gmail.com
Regd. Address: 133, Bhagirathi Appts., Plot No. 13/1, Sector-9, Rohini, New Delhi-110085, Regd. E-mail: sanjaydewani@gmail.com

Date: 16.02.2019
Place: New Delhi

HPL ELECTRIC & POWER LIMITED	
CIN: L74899DL1992PLC048945	
Regd. Office: 1/20, Asaf Ali Road, New Delhi 110 002	
Ph.: +91-11-23234411, Fax: +91-11-23232639	
E-mail: hpl@hplindia.com , Website: www.hplindia.com	

POSTAL BALLOT NOTICE

Members are hereby informed that in terms of the provisions of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the company has on 15th February, 2019 completed the dispatch of the Postal ballot Notice dated 13th February, 2019, along with the Postal Ballot form:

(i) Through email to members (as on 8th February, 2019 being the cut-off) whose names appeared in the Register of Members/Record of Depositors at their postal addresses or e-mailed at e-mail addresses, registered with the Registrar and Transfer Agent/Depository Participant, as the case may be and

(ii) Through physical mode, alongwith a postage prepaid self addressed Business reply Envelope to other members (whose email addresses are not registered),

For seeking approval of the members of the company by way of special resolution(s) for (a) Re-appointment of Mr. Lalit Seth (DIN:00312007) as the Chairman and Managing Director of the Company and to fix his remuneration (b) Re-appointment of Mr. Rishi Seth (DIN:00203469) as the Joint Managing Director of the Company and to fix his remuneration (c) Re-appointment of Mr. Gautam Seth (DIN:00230405) as the Joint Managing Director of the Company and to fix his remuneration (d) Re-appointment of Mr. Chandra Prakash Jain (DIN:00311643) as the Whole-time Director of the Company and to fix his remuneration through Postal ballot which also includes voting by electronic means i.e. Remote e-voting.

The company has engaged the services of Karvy Fintech Private Limited (Karvy) for providing remote e-voting facility to the members of the Company.

The Board of Directors of the Company by resolution has appointed Mr. Vinod Kumar Gupta, Proprietor, M/s. Gupta Vinod & Company, Practicing Company Secretary, as the Scrutinizer for conducting the postal ballot process in a fair and transparent manner.

All members are, therefore, informed that:

- Date of completion of dispatch of Notice of Postal Ballot is 15th February, 2019.
- The voting through Postal Ballot and remote e-voting shall commence on Saturday, 16th February, 2019 at 10:00 AM (IST) and shall end on Sunday, 17th March, 2019 at 5:00 PM (IST). The remote e-voting module shall be disabled thereafter and will not be allowed beyond 5:00 PM (IST) on 17th March, 2019.
- The voting rights of the members (through Postal Ballot form or Remote e-voting) shall be reckoned on the equity shares held by them as on 8th February, 2019, being the cut-off date for this purpose. The person who is not a member as on the cut-off date should treat this Notice for information purpose only.
- The Postal Ballot form, duly completed and signed by the member(s) shall have to be returned in the postage prepaid self addressed Business Reply Envelope to the Scrutinizer so as to reach the Scrutinizer not later than Sunday, 17th March, 2019 by 5:00 PM (IST). Any postal ballot form received after the said date shall be treated as if the reply from the member(s) has not been received.
- In case a member is desirous of obtaining Postal ballot in printed form or a duplicate thereof, the member may write to the Company at its registered office or download the Postal Ballot Form from the Company's website www.hplindia.com or from the website of Karvy i.e. <https://evoting.karvy.com>, alternatively, he/she can send an email to Karvy at inward_ris@karvy.com or to the company at hplcs@hplindia.com. The Registrar and Transfer Agent will forward the same alongwith Postage prepaid self addressed Business Reply Envelope upon receipt of a request from the member. However, the duly filled in duplicate form should reach the scrutinizer not later than 5:00 PM at Sunday, 17th March, 2019.
- A member can opt only one mode of voting i.e. Postal Ballot form or remote e-voting, if a member casts vote by both the modes, then the votes cast through remote e-voting shall prevail.
- In case of any grievance/query connected with Postal Ballot or remote e-voting, Members are requested to contact Mr. P. Nageswara Rao, Manager, Karvy Fintech Private Limited, Karvy Selenium, Tower B, Plot No. 31 & 32, Financial District, Gachibowli, Hyderabad - 500 032, Toll Free No. 1800-345-4001, E-mail: inward_ris@karvy.com, Website: www.karvy.com for the resolution as contained in the Postal Ballot Notice. The said Postal Ballot notice alongwith Postal Ballot form is also available on the website of the Company at www.hplindia.com and on the website of Karvy at www.karvy.com.

The Results of the Postal Ballot (including remote e-voting) shall be declared on or before, Tuesday, 19th March, 2019 by 2:00 PM on the website of the company at www.hplindia.com. The results of the Postal Ballot and the Report of the scrutinizer shall also be displayed on the notice board of the Company's Registered Office and Corporate Office, immediately after the declaration of the result by the Chairman or a person authorized by him in writing and after the results are communicated to BSE Limited and the National Stock Exchange of India Limited, on which the Company's Equity Shares are listed.

By order of the Board
For HPL Electric & Power Limited

Vivek Kumar
Company Secretary
M. No. A18491

Date: 15.02.2019
Place: Noida

Registered Office: Khush Housing Finance Pvt Ltd, 810, Aura Biplax S V Road, Borivali west - 400092
Registered Office: Khush Housing Finance Pvt Ltd, 810, Aura Biplax S V Road, Borivali west - 400092
Whereas

The undersigned being the Authorized Officer of Khush Housing Finance Private Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrower/s have failed to repay the amount. Notice is hereby given to borrower/s and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Khush Housing Finance Private Limited.

Sr. No	Name of the Borrower/ Loan Account Number	Description of property/ Date of Symbolic Possession	Date of Demand Notice/Amount in Demand Notice (Rs)	Name of the Branch
1	SACHINSINGH MADHAVSINGH SOLANKI/ LXAHM01916-170000126	B-101 1ST FLOOR BLOCK NO B-SAUMYA RESIDENCY OPP SAGUN COMPLEX NARODA NIKOL - NIKOL- AHMEDABAD-382330- GUJARAT-INDIA/ February 11 th 2019	24-10-2018/ 897305	AHEMADABAD
2	PINTU KUMAR PANDE/ LXSUR00516-170000337	201-KAMDHENU RESIDENCY, KADODARA, PALSANA, SURAT- 394305 - GUJARAT - INDIA/ February 11 th 2019	19-10-2018/ 514227	SURAT
3	JAYKUMAR RAMASARE KANAUJIYA/ LXSUR01817-180001107	FLAT NO: 307, MAITRI RESIDENCY, NEAR, MADHAV SCHOOL-SURAT BARDOLI ROAD, SONI PARK -2, TATTHAIYA, PALSANA- SURAT - 394305 - GUJARAT - INDIA February 11 th 2019	19-10-2018/ 300763	SURAT

The above mentioned borrower(s)/guarantor(s) is/are hereby given a 30 days' Notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date : 15.02.2019
Place : Gujarat

Sd/-
Authorized Officer
Harshita Kanoojia
Khush Housing Finance Private Limited

TRIGYN TECHNOLOGIES LTD.
Regd. Office: 27, SDF I, Seepz, Andheri (East), Mumbai - 400096
Tel: +91 22 6140 0909 Fax: +91 22 2829 1418 Website: www.trigyn.com Email: ro@trigyn.com
CIN - L72200MH1986PLC039341

NOTICE

Members of the Company are hereby informed that pursuant to Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 and as per provisions of SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015 ["LODR Regulations"], the Company has completed the dispatch of Postal Ballot Notice along with Postal Ballot Form on 16th February, 2019 through electronic mail to those shareholders who have registered their e-mail addresses with the Depositories and through physical mode along with a self-addressed postage prepaid Business Reply Envelope to the remaining shareholders whose names appear in the Company's Register of Members as at the closure of business hours on 1st February, 2019, in relation to special resolutions for seeking approval of the shareholders by Postal Ballot, including e-voting by electronic means.

The Board of Directors has appointed Mr. Anmol Jha, Practicing Company Secretary, as the Scrutinizer for conducting the Postal Ballot process in a fair and transparent manner. As required under LODR regulations, the company has engaged the services of Karvy Fintech Private Limited ("Karvy") to provide electronic voting facility to the Members of the Company as an alternate. The detailed procedure/instructions for e-voting forms part of the Postal Ballot Notice. In this regard, the Members are hereby notified that:

- The Company has completed dispatch of Notice of Postal Ballot along with Postal Ballot Form and a self-addressed postage prepaid Business Reply Envelope on 16th February, 2019 to the Members whose names appear in the Company's Register of Members as at the closure of business hours on 1st February, 2019 by the permitted mode of dispatch.
- The cut-off date (record date) as on which the voting rights of members shall be reckoned is 1st February, 2019. A person who is not a member as on record date should treat this Notice for information purpose only.
- Voting through physical and electronic means shall commence from 10.00 a.m. on 20th February, 2019 and ends at 5.00 p.m. on 21st March, 2019.
- Voting through physical and electronic means shall not be allowed beyond 5.00 p.m. on 21st March, 2019.
- All Postal ballot forms should reach the scrutinizer by not later than 5:00 p.m. on 21st March, 2019 and any postal ballot received from the member beyond the said date and time will not be valid and voting by post shall not be allowed beyond the said date and time.
- In case of non-receipt of Notice of Postal Ballot along with Postal Ballot forms, a member may as on the cut-off date can either download the same from the website of the Company viz. www.trigyn.com or the website of Karvy <https://evoting.karvy.com> or apply to the Company/Share Transfer Agent: Karvy Fintech Private Limited (Karvy) by sending an e-mail to evoting@karvy.com to obtain duplicate copy thereof.
- In case of any grievances connected with the voting by Postal Ballot may be addressed to the Compliance Officer at the Registered Office of the Company or through email sent at ro@trigyn.com. For any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual for members available on the website <https://evoting.karvy.com> under the 'Download Section' or contact Karvy by email at evoting@karvy.com or call on: (040) 67162222.
- The results of the Postal Ballot will be announced by the Chairman or the Company Secretary of the Company on Saturday, March 23, 2019 at the registered office of the Company. The results along with the report will be posted on the website of the Company: www.trigyn.com and on Karvy's website viz: <https://evoting.karvy.com> besides communicating to the Stock Exchanges where the Company's shares of the Company are listed.

For Trigyn Technologies Limited
Sd/-
Mukesh Tank
Company Secretary

Place: Mumbai
Date: February 16, 2019

Manaksia Steels Limited
AN ISO 9001 : 2015 COMPANY

Corporate Identity Number: L27101WB2001PLC138341
Registered office : Turner Morrison Building, 6, Lyons Range, First Floor, Kolkata - 700001
E-mail: info.steels@manaksia.com, Website: www.manaksiasteels.com
Phone: +91-33-2231 0055 / +91-33-2231 0056

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2018

Particulars	Quarter Ended		
	31st Dec 2018	Nine Months Ended 31st Dec 2018	31st Dec 2017
Total Income from Operations	19506.41	48778.18	11941.45
Net Profit/(Loss) before taxes	663.06	1208.72	726.01
Net Profit/(Loss) after taxes	361.99	716.37	417.18
Total Comprehensive Income [Comprising Profit / (Loss) after tax and Other Comprehensive Income after tax]	292.41	977.62	417.18
Equity Share Capital	655.34	655.34	655.34
Earnings per share (of Re 1/- each) (Not annualised):			
(a) Basic (₹)	0.55	1.09	0.64
(b) Diluted (₹)	0.55	1.09	0.64

Particulars	Quarter Ended		
	31st Dec 2018	Nine Months Ended 31st Dec 2018	31st Dec 2017
Total Income from Operations	19435.63	48859.69	11877.61
Net Profit/(Loss) before taxes	852.44	1381.35	882.44
Net Profit/(Loss) after taxes	551.37	889.00	573.61

NOTES :

- The Unaudited Financial Results of the Company for the Quarter and Nine Months ended 31st December, 2018 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on 14th February, 2019. The Statutory Auditors of the Company have carried out Limited Review of these results.
- The Consolidated Financial Results comprise of Manaksia Steels Limited, its wholly owned subsidiary, Technomet International FZE incorporated on 3rd August, 2017 and its step-down subsidiaries, Federated Steel Mills Limited and Far East Steel Industries Limited, acquired as on 17th December, 2017.
- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.manaksiasteels.com.
- The Unaudited financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended by the Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2016. The Company adopted Ind AS from 1st April, 2017, and accordingly, these financial results (including for all the periods presented in accordance with Ind AS 101 - First-time Adoption of Indian Accounting Standards) have been prepared.
- Comparative figures have been rearranged / regrouped wherever necessary.

For and on behalf of the Board of Directors
Manaksia Steels Limited

Varun Agrawal
(Managing Director)
DIN - 00441271

Place : Kolkata
Date : 14th February, 2019

Bank of Baroda
India's International Bank

POSSESSION NOTICE
(Immovable property)

Whereas, The undersigned being the Authorised officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice dated 09-10-2018 calling upon the borrower M/S Charon Hotels & Resorts Pvt. Ltd. through its Directors Mr. Himanshu Harishbhaji Agrawal and Mr. Amit Sidkar to repay the amount mentioned in the notice being Rs. 50,09,379.60/- (Rupees Fifty lacs Nine thousand three hundred seventy nine Rupees and sixty Paise Only) and interest thereon w.e.f. 29-06-2018 within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower/mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 14th day of February the year 2019.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, M.S. University Campus, Vadodara for an amount of Rs. 50,09,379.60/- (Rupees Fifty lacs Nine thousand three hundred seventy nine Rupees and sixty Paise Only) and interest thereon.

Description of the Immovable Property

Equitable Mortgage of immovable property being Commercial Shop No (1) at 4 at Ground Floor admeasuring construction area 234.00 sq ft i.e 21.74 sq mtrs & (2) & Commercial shop No 5 admeasuring construction area, 228.00 sq ft i.e 21.19 sq mtrs along with undivided shared land area 15.21 sq mtrs, both bearing Muni Property No 1377/1378/G/4/5 in AMBA BHUVAN complex situated on C. S No 1977, admeasuring 836.86 sq mtrs, within limits of village V V Nagar Ta & Dist Anand. The said property is located at shop Nos 4 & 5 Amba Bhavan, AP V V Nagar, Ta & Dist Anand belongs to Mr. Himanshu Harishbhaji Agrawal. The said property is bounded as under : East : By Public Road by Leaving Passage , West: By Shop No G/3 at GF with common Wall, North : By Shop No G/6 at GF with common Wall, South : By Public Road by leaving passage Above by : Flat, Below by : Basement

Place : Baroda, Date : 16-02-2019
Authorised Officer, Bank of Baroda

Infosys Limited
Navigate your next

Infosys Limited
CIN : L85110KA1981PLC013115
44, Infosys Avenue, Electronics City, Hosur Road, Bengaluru - 560 100
Phone: 91 80 2852 0261, Fax: 91 80 2852 0362
investors@infosys.com, www.infosys.com

NOTICE OF LOSS OF SHARE CERTIFICATES

The following share certificate(s) of the company have been reported as lost/misplaced and the holder(s)/claimant of the said share certificate(s) have requested the company for issue of duplicate share certificate(s).

Notice is hereby given that the company will proceed to issue duplicate share certificate(s) to the below mentioned claimant unless a valid objection is received by the company within 15 days from the date of publication of this notice. No claims will be entertained by the company with respect to the original share certificate(s) subsequent to the issue of duplicates thereof.

Name of Shareholder	Folio No.	Certificate No.	Distinctive Nos.		No. of Shares
			From	To	
B N Subramanya (shareholder - deceased) Prabhavathi (Claimant)	ITL950030	1000196	1150149356	1150149395	40

Any person who has/have a claim in respect of the said certificate(s) should lodge his/her claim with all supporting documents with the company at its registered office. If no valid and legitimate claim is received within 15 days from the appearance of this notice, the company will proceed to issue duplicate share certificate(s) to the person listed above and no further claim would be entertained from any other person(s).

Registered Office:
Electronics City, Hosur Road,
Bengaluru - 560 100

February 15, 2019
Bengaluru, India

For Infosys Limited
Sd/-
A.G.S. Manikanta
Company Secretary

HDFC MUTUAL FUND
BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited
A Joint Venture with Standard Life Investments
CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676
Fax: 022 22821144 • e-mail: cliser@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

NOTICE is hereby given that HDFC Trustee Company Limited, Trustee to HDFC Mutual Fund ("the Fund"), has approved the declaration of dividend in the Dividend Option(s) offered under the following Scheme(s) / Plan(s) of the Fund and fixed the Record Date as **Thursday, February 21, 2019** (or the immediately following Business Day, if that day is not a Business Day):

Name of the Scheme / Plan / Option	Amount of Dividend# (₹ per unit)	Impact of Dividend Distribution on NAV (₹ per unit)	Face Value (₹ per unit)	Net Asset Value as on February 14, 2019 (₹ per unit)
HDFC Focused 30 Fund - Regular Plan - Dividend Option (Payout and Reinvestment)	1.75	1.976	10.00	16.529
HDFC Focused 30 Fund - Direct Plan - Dividend Option (Payout and Reinvestment)				17.904
HDFC Capital Builder Value Fund - Regular Plan - Dividend Option (Payout and Reinvestment)	2.75	3.106		26.448
HDFC Capital Builder Value Fund - Direct Plan - Dividend Option (Payout and Reinvestment)				28.330
HDFC Arbitrage Fund - Wholesale Plan - Regular Plan - Normal Dividend Option (Payout and Reinvestment)			10.00	10.408
HDFC Arbitrage Fund - Wholesale Plan - Direct Plan - Normal Dividend Option (Payout and Reinvestment)	0.050	0.056	10.00	10.772
HDFC Arbitrage Fund - Wholesale Plan - Regular Plan - Monthly Dividend Option (Payout and Reinvestment)				10.823
HDFC Arbitrage Fund - Wholesale Plan - Direct Plan - Monthly Dividend Option (Payout and Reinvestment)				10.495

The dividend will be subject to the availability of distributable surplus and may be lower, depending on the distributable surplus available on the Record Date.

Pursuant to payment of dividend, the NAV of the Dividend Option(s) of the above Schemes / Plans would fall to the extent of payout and statutory levy, if any.

Income distribution / Dividend will be paid to those Unit holders / Beneficial Owners whose names appear in the Register of Unit holders maintained by the Fund / Statement of Beneficial Ownership maintained by the Depositories, as applicable, under the Dividend Option(s) of aforesaid Schemes / Plans on the Record Date.

With regard to Unit holders of the aforesaid Schemes / Plans who have opted for Reinvestment facility under the Dividend Option(s), the dividend due will be reinvested by allotting Units for the Income distribution / Dividend amount at the prevailing ex-dividend NAV per Unit on the Record Date.

Unit holders who have not opted for Dividend payout through electronic mode(s) are advised to opt for the same at the earliest due to the inherent benefits of such mode(s) such as convenience of direct credit of the proceeds into the bank account as also avoiding loss of payment instruments in transit or fraudulent encashment. Please update the IFSC and MICR Code in order to get payouts via electronic mode into the bank account.

Intimation of any change of address / bank details should be immediately forwarded to the Investor Service Centres of the Fund (for units held in non-demat form) / Depository Participant (for units held in demat form).

For HDFC Asset Management Company Limited
Sd/-
Date : February 15, 2019
Chief Compliance Officer

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

